

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦,૨૫૬૩૦૨૦૦,૨૫૬૩૦૩૦૦,૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૩૦/૧/૨૦૧૫ શુક્રવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર
શહેર પોલીસ ધ્વારા કરવામાં આવેલ પ્રશંસનીય/નોંધપાત્ર કામગીરી:- સમાચાર યાદી નં.૨૦૦/૧૫

આંગડીયા પેઢીના સુ. ૭૫ લાખની લુંટના બનાવમાં વધુ બે
આરોપીઓને ઝડપી પાડતી ફાઇન બ્રાન્ચ :

ગઈ તા. ૨૧.૧૧.૨૦૧૪ ના રોજ સવારના દસેક વાગ્યાના સુમારે શિવદર્શન એપાર્ટમેન્ટ પાસે આવેલ સોપાન શરણમ ફલેટના દરવાજા આગળથી ગણેશ પ્રકાશ કાંતી નામની આંગડીયા પેઢીના બે કર્મચારીઓને હથિયાર બતાવી ફાયર કરી ઈજાઓ પહોંચાડી લુંટારુઓ સુ. ૭૫ લાખની માતબર રકમની લુંટ ચલાવી નાસી ગયેલા. જે અંગે સોલા હાઈકોર્ટ પો. સ્ટે. ફ. ગુરનં. ૩૩૨/૧૪ મુજબનો ગુનો દાખલ થયેલ.

આ ગુન્હાના ત્રણ આરોપીઓને ગઈ તા. ૨૭.૧.૨૦૧૫ ના કલાક ૨૧.૦૦ વાગે પકડી અટક કરવામાં આવેલ. જેઓની ઘનિષ્ઠ પુછપરછ દરમ્યાન અન્ય આરોપીઓના પુરા નામો મળી આવતા જેઓને શોધી કાઢી પકડી પાડવા સારું પો. ઈન્સ. શ્રી એસ. એલ. ચૌધરી તથા તેમની ટીમના અધિ. તથા માણસોએ હાથ ધરેલ ક્વાયત દરમ્યાન આરોપીઓ (૧) મિલન જ્યંતીભાઈ સોલંકી રહે. એ/ટ, કંકુભાનગર, જગતપુર રોડ, ચાંદલોડીયા અમદાવાદ તથા (૨) શૈલેષસીંહ ઉર્ફે લાલાભાઈ ઉર્ફે લાલીયો ઉર્ફે ટોંટીયો દલપુજી ડાભી રહે. પ્રભુનગર સોસાયટી સામે, રબારીવાસ, રોયલ મોબાઈલ સામે, અસારવા અમદાવાદ નાઓને તા. ૨૮.૧.૨૦૧૫ ના કલાક ૧૮.૦૦ વાગે કાલુપુર કપાસીયાબજાર સામે મ્યુની. બસ સ્ટેન્ડ આગળ જાહેર રોડ ઉપરથી એક એગ્નેટર મો. સા. તથા રોકડ નાણાં સુ. ૫૮,૭૦૦.૦૦ સાથે ઝડપી પાડેલ છે.

ઉપરોક્ત પકડાયેલ બન્ને આરોપીઓએ આ લુંટના ગુનામાં પોતાનો ભાગ ભજવેલ હોવાનું અને તેઓ પાસેથી મળી આવેલ રોકડ રકમ આ લુંટમાંથી મળેલ નાણા પૈકીના હોવાનું જણાઈ આવેલ છે. તેમજ આરોપી મિલનના કબજાની એગ્નેટર મો. સા. આ લુંટનો ગુનો કરતી વખતે વાપરેલ હોવાનું તપાસ દરમ્યાન જણાઈ આવેલ છે.

આરોપીઓની હજુ વધુ અને ઘનિષ્ઠ પુછપરછ ચાલુ છે અને આ આરોપીઓની પુછપરછ દરમ્યાન આવા પ્રકારના લુંટના અન્ય ગુન્હાઓ પણ ડીટેક્ટ થવાની શક્યતાઓ રહેલ છે.

સાડા ત્રણેક વર્ષ અગાઉના ઘરફોડ ચોરીમાં તથા છ - સાત માસ અગાઉની મોબાઇલ ચોરી ગુનામાં

એક આરોપીની ધરપકડ કરી ચોરીના બે ગુના ડીટેક્ટ કરતી

અમદાવાદ શહેર એસ.ઓ.જી. કાઇમબ્રાન્ચ.

નાયબ પોલીસ કમિશ્નર શ્રી હિમાંશુ શુક્લા કાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી બી.સી.સોલંકી, એસઓજી કાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી.ડી.જાડેજા એસ.ઓ.જી. કાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર નાઓએ મીલકત સંબધી બનેલ ગુના શોધી કાઢવા તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડવા આપેલ સુચના મુજબ અમદાવાદ શહેર વિસ્તારમાં પો.સ.ઇ. શ્રી વી.એચ.જાડેજા તથા પો.સ.ઇ. શ્રી સી.બી.ગામીત નાઓની ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન ફરતા ફરતા નારોલ સર્કલ વિલ્સમ હોટલ ખાતે આવતા સાથેના પો.કો. જીતેન્દ્રકુમાર ત્રિકમલાલ તથા પો.કો. અનિરુદ્ધસિંહ મહીપતસિંહ નાઓએ આપેલ બાતમી હકીકત આધારે ઇમરાન ઉર્ફે પાવડરીયો સ/ઓ બાબુભાઇ શેખ ઉવ.૩૦ રહે, ચંડોળા તળાવની પાળ, ચંડોળા ચોકી સામે, ઝુપડામાં, ઇસનપુર, અમદાવાદ શહેર નાનો મળી આવેલ. સદરી ઇસમની અંગઝડતી તપાસ કરતાં તેની પાસેથી એક બ્લેક સીલ્વર કલરનો એચ.ટી.સી. કંપનીનો મોબાઇલ મળી આવેલ. જે મોબાઇલ ફોન નું બીલ કે કોઇ લખાણ હોય તો રજૂ કરવા પંચો રૂબરૂ જણાવતાં સદરીએ પોતાની પાસે કોઇ પુરાવો નહીં હોવાનું જણાવેલ તેમજ યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતાં જણાવેલ કે, આજથી આશરે છ-સાત માસ અગાઉ પોતે ગોવિંદવાડી શાક માર્કેટ માંથી એક ઇસમનો ફોન ચોરી કરેલાનું જણાવેલ. તેમજ સદરી ઇસમને વધુ પુછપરછ કરતાં આજથી ત્રણેક વર્ષ અગાઉ ગોવિંદવાડી વિશાલનગર સોસાયટીના ત્રણ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયાની ચોરી કરેલાનું જણાવેલ. જેથી સદર બનાવ બાબતે ઇસનપુર પો.સ્ટે.ખાતે તપાસ કરાવતાં મોબાઇલ ચોરી બાબતે ઇસનપુર પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૮૯/૧૪ ધી ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુનો તેમજ સોના -ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા બાબતે ઇસનપુર પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૧૨૭/૧૧ ધી ઇપીકો કલમ ૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો નોંધાયેલ હોવાની હકીકત જણાયેલ છે. જે સદરહું મળી આવેલ મોબાઇલ કિ.રૂ.૧૦,૦૦૦/- નો સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ પંચનામાં વિગતે કબજે કરવામાં આવેલ છે. અને સદરહું આરોપીને આજરોજ તા.૨૯/૦૧/૧૫ ના કલાક ૧૫/૦૦ વાગે સીઆરપીસી કલમ ૪૧(૧) ડી મુજબ અટક કરવામાં આવેલ. અને વધુ તપાસ અર્થે આરોપી તથા કાગળો ઇસનપુર પોલીસ સ્ટેશન મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે.

નાયબ પોલીસ કમિશ્નર
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર
પોલીસ કમિશ્નર વતી.